



Gujarat Public Service Commission

Result

List of Eligible Candidates for Interview (REVISION)

Advertisement No. 47/2016-17

વંચાણે લીધી : (1) આયોગની તા.15.05.2017, તા.17.02.2018 અને તા.07.05.2018ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી
(2) આયોગની તા.14.06.2018ની રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

1. આયોગ દ્વારા પ્રસિધ્ધ થયેલ ગૃહ વિભાગ હસ્તકની ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી હેઠળની સાયન્ટીફિક ઓફિસર (બાયોલોજી), વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 47/2016-17ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.29.01.2017ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ ક્રમાંક: (1) પરની યાદીઓથી અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 69 ઉમેદવારો ના બેઠક નંબરોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજી ચકાસણીને અંતે તા.14.06.2018ના રોજ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા 27 ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
2. આ જગ્યાની જાહેરાત તા.18.10.2016ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તથા તેમાં ઓન-લાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 03.11.2016 નિયત થયેલ છે. આ જગ્યાની જાહેરાતની અનુભવ અંગેની જોગવાઈ અનુસાર ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ નિયત સમયગાળાના નિયત અનુભવની લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 03.11.2016 ના રોજ ધરાવતા હોવા જોઈએ.
3. આયોગની કચેરી દ્વારા તા.14.06.2018ના રોજની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં બેઠક નં.101000331 પરના ઉમેદવારને નિયત અનુભવ ધરાવતા ન હોય, રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવામાં આવેલ હતા.
4. સદરહુ ઉમેદવારે અનુભવની લાયકાત અંગે આયોગને કરેલ રજૂઆત અન્વયે આયોગના નિર્ણય અનુસાર માન્ય ગણી રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણતાં, હવે આયોગના તા.14.10.86ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગના ઉમેદવારોની કુલ 02 જગ્યા માટે નોર્મ્સ મુજબ 08 ઉમેદવારોને મેરીટ ક્રમાંક મુજબ રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના રહે છે.
5. આથી, રૂબરૂ મુલાકાત માટે પાત્ર થયેલ સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગની મેરીટ યાદીના બેઠક નંબર.101000382 પરના છેલ્લા ઉમેદવાર હવે સા.શૈ.પ.વર્ગ (કોમન) વર્ગના રૂબરૂ મુલાકાત

માટે નિયત લાયકી ધોરણ ધરાવતા ન હોય અપાત્ર ગણી યાદી હેઠળની નોંધ (2): “જાહેરાતની જોગવાઈઓ પરિપુર્ણ કરે છે, પરંતુ આયોગે રૂબરૂ મુલાકાત માટે નક્કી કરેલ લાયકી ધોરણ **(Passing standard)** ધરાવતા ન હોય રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં સમાવેશ કરવામાં આવે છે, અને તે સંખ્યા હવે 04 થાય છે. તથા બેઠક નંબર:101000331 પરના ઉમેદવારને યાદી હેઠળની નોંધ (1) “આયોગે રૂબરૂ મુલાકાત માટે નક્કી કરેલ લાયકી ધોરણ **(Passing standard)** ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપુર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” માંથી બાદ કરતાં આ સંખ્યા હવે 31 થાય છે. આયોગની કચેરી દ્વારા તા.14.06.2018ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 24.07.2018

(સંયુક્ત સચિવ)

ગુજરાત જાહેર સેવા આયોગ